

કલાઈમેટ ચેઇન્જ ધાર્ય કરતાં વધુ ગંભીર છે

અલિથિ કોલમ

- ડૉ. રાજુવ કે. ગુપ્તા

૧૮મી ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ પર્યાવરણવાદી ફિલ્મ નિર્માતા એમ. મેન્ડેલલઠીને અને ડેલિમ મેન્ડેલલિનું એક દસ્તાવેજ ચિત્ર 'નોટ ઈવિલ જસ્ટ રોંગ' રિલીઝ થયું. તેમાં દર્શાવ્યા મુજબના કલાઈમેટ ચેઇન્જનો કોઈ બદ્દ નથી એવા ધ્યાનો સાથે વિવાદ જરૂરથો. નોંધેલ પ્રાઈવેલ વિષેતા સંયુક્ત રાખ્ર પ્રાયોળિત આઈપીસી (ઈન્ટર ગવરનિન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેઇન્જ) અને તેના વધુ વાચાન એવા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અધ્યક્ષ ગોરના મંત્ર્યાંથી તે વિરુદ્ધ છે. આપણે ખરેખર હકીકતો વધુ નશીક્યી જીવણાની જરૂર છે.

વર્ષ ૨૦૦૭માં સૌંપ્રથમ વખત અનેક વર્ષો બાદ આઈપીસીસીને વિશ્વાના ઉષ્ણતામાનમાં ઓછામાં ઓછા ૨ ડિગ્રી સેલ્સિયસના વધારાની જરૂરેચાત કરી હતી. એ વિશ્વિક અરભીને કારણે થશે. પરિસ્થાતે આ ૨ (બે) ડિગ્રી સેલ્સિયસ અંતરસાખ્યીય મંદ્યોની ચર્ચા-વિશ્વારસાનો મુખ્ય વિષય બન્યું હેલા. પર પોત્તાનાન સમિદ્ધી તાજેતરમાં મળેલ છુટ્ટ-છુટ્ટ અને છુટ્ટ-છુટ્ટ સિખર પરિષ્ઠદ્યોમાં વિશ્વાના નેતાઓને ચર્ચા-વિશ્વારસા કરી, પરં દુલ્હિયવશ તાજેતરમાં નાસાએ એ નિરીક્ષણ કર્યું તે ચોંકાવનાર્દું છે. તેમાં જીવણવાનું છે કે, સમય વિશ્વામાં ગ્રેસિયર ઓળખાની રહ્યા છે અને તેના પરિસ્થાતે એવું હીઢી શકાય કે, આઈપીસીસીના અંદાજ દરિયાની જીવાદીમાં સાતાનીના અંતે સંભવિત ૧૯ ડિગ્રી વધારાનો ૨-૧/૨ બન્યું રહ્યો. મીનલેનનો મોટો ભાગ ઓળખાની દરિયાની સંપાદીનો વધારો ૪૦ હુંબની આસપાસ રહેશે. પરિસ્થાતે બાંગલા દેશ જેવા દેશોનું અલિન્ટ્યુડ ૪ નાઈ રહે. આપણે જુલાસાને ખૂલ્યું ન હોઈએ, કારણ કે તેનો સાગરકાંદો ૧૦૦ ડિસોમીટરનો છે. દેશમાં લાંબામાં લાંબાં તટ છે અને દરિયાની સંપાદી વર્ષો ના તેના નંબર થશે. મોટી અરતી અને દરિયાની માર્ગને કારણે જીવાનું અને કંદળની અમૃત્ય જર્માના અને અનેક અંતરમાળાની સંપાદી સંવાદ જેવું થશે.



દુસ્તાના પાંચબા ભાગ કેટલો વધારો થયો છે. ૬૨ વર્ષસે ૫૦ ક્ષુભીક માર્ગિલ હિમ નાસ પામે છે. એ ખરેખર આઈપીસીસીની ભવિષ્યપાત્રી કરતાં વધુ છે. આ વ્યાપકતાને કારણે પૂર્વ પ્રદેશને અસર થશે. પૂર્વ પ્રદેશના પાણીના વધારાને કારણે સુર્યની ઉષ્ણતા વધુ પ્રમાણમાં શોધાશે, કારણ કે હિમના પ્રમાણમાં ઘટાડો થવાનો જ છે. પરિસ્થાતે સુર્યનો પ્રકાશ, તડકો વંગેદેને કારણે ઊનાણમાં જરભીનું પ્રમાણ વર્ષો. સિથાળામાં આ ગરભી વધુમાં પ્રસરણો અને ૧૯૮૦માં નોંધાયેલ ઉષ્ણતામાન ડરનાં ૧૦ ડિગ્રી ઉષ્ણતામાન રહારસે. આ તમામ ભાગોને ઘણામાં કેતાં કેટલાક વિશ્વાનીઓએ આગાહી

કરી છે કે, આઈપીસીસીનીનો અંદાજ દરિયાની સંપાદીમાં સાતાનીના અંતે સંભવિત ૧૯ ડિગ્રી વધારાનો ૨-૧/૨ બન્યું રહ્યો. મીનલેનનો મોટો ભાગ ઓળખાની દરિયાની સંપાદીનો વધારો ૪૦ હુંબની આસપાસ રહેશે. પરિસ્થાતે બાંગલા દેશ જેવા દેશોનું અલિન્ટ્યુડ ૪ નાઈ રહે. આપણે જુલાસાને ખૂલ્યું ન હોઈએ, કારણ કે તેનો સાગરકાંદો ૧૦૦ ડિસોમીટરનો છે. દેશમાં લાંબામાં લાંબાં તટ છે અને દરિયાની સંપાદી વર્ષો ના તેના નંબર થશે. મોટી અરતી અને દરિયાની માર્ગને કારણે જીવાનું અને કંદળની અમૃત્ય જર્માના અને અનેક અંતરમાળાની સંપાદી સંવાદ જેવું થશે.

થઈ જશે.

તાજેતરના એક તાજી અભ્યાસ મુજબ એક નવું પરિમાણ તેમાં ઉમેરાયું છે અને તે છે 'પર્માન્ઝિસ્ટ.' એટલે કે પૂર્વ પ્રદેશમાં જમીનની સપાદી નીચે કાયમી પોરસો જમીન જેવેલું હિમનું પડ પીણાથી રહ્યું છે. આ મહિયા ઉષ્ણું પ્રદેશમાં મોટા પાણે થઈ રહી છે. વિશ્વિક ઉષ્ણતામાન વર્ષી રહ્યું છે, કારણ કે કાર્બન કાયમી પડમાં સંબંધાયેલો હતો તે ઉષ્ણતામાનમાં પ્રસરી રહ્યો છે. પરિસ્થાતે હિમ વધુ પ્રમાણમાં પીણાયે છે. ૬૨ વર્ષસે ૧ અભજીયી ર અભજીટન કાર્બન પ્રયોગીકાર્ય વાતાવરણમાં ભાગો છે (અમેરિકામાં ઓટોમોબાઈલમાંથી દર વર્ષસે ૩૦૦ મિલિયન ટન કાર્બન હવામાં છોડવામાં આવે છે). આમ નાસાના વિશ્વાની દરિયાની માને છે કે, મીનલેન ઓળખાને કારણે અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધવાયી ર ડિગ્રી સેલ્સિયસનું ઉષ્ણતામાન વર્ષે તેની રાની જોવી નથી પડે. અગ્રાઉ આવા પરિસ્થાતો વિશ્વ વિશ્વારાયું ૪ ન હતું. પરિસ્થિતિ ગંભીર છે. 'કલાઈમેટ કોડ રેડ' (સીસીઆર) માટે હાડ્ય કરવાની જરૂર છે. તેનો અર્થ એ કે, આપણે જેણની કટોકદીના પુગમાં પ્રવેશી ચૂક્યા છીએ અને ખૂબ દૂષા ગાળામાં ૪ દુનિયાનું ઉષ્ણતામાન ર ડિગ્રી સેલ્સિયસ સરેરાત વર્ષી જશે. પરિસ્થાતે કંબા દુષ્યાણ, પૂર રંગેર જોવી કુદરતી આહુતો આપણા અને ખેતી તેમ જ અંતરમાળાની નુકસાન થશે. આમ કોઈ દસ્તાવેજ ચિત્ર દરાચ હવામાનમાં હેરારના પડકારને હજવાશાયી લેવો તે મૂર્ખાંઓના સર્વર્માં રાસવા જેવું થશે.

(લેખક : ગુજરાત સરકારમાં કલાઈમેટ ચેઇન્જ વિભાગના લખિય છે)